

કેડિટ સ્કોર શું છે?

કેડિટ સ્કોર ત્રણ આંકડાનો નંબર છે, જે બેન્ક અથવા ધિરાણદારને તમારી ધિરાણ પાત્રતાનો અંદાજ આપે છે, એટલે કે, તમે તમારાં લેણાં નિયમિત રીતે પુનઃચુકવણી કરી રહ્યા છો કે નહીં. જો કેડિટ સ્કોર સારો હોય તો ધિરાણદાર સમજે છે કે તમે ભૂતકાળમાં લોન અને કેડિટ કાર્ડસનો ઉપયોગ કર્યો છે અને સર્વ લેણાં યોગ્ય અને નિયમિત રીતે પુનઃચુકવણી કરાયાં છે. આથી ધિરાણદાર લોન અથવા કેડિટ કાર્ડ માટે તમારી વર્તમાન અરજી મંજૂર કરવામાં અનુકૂળતા રહે છે.

સીઆરઆઈએફ કેડિટ સ્કોર સામાન્ય રીતે 300-900 વચ્ચે હોય છે. 300 સૌથી ઓછો સ્કોર છે, જે નબળો કેડિટ સ્કોર દર્શાવે છે, જ્યારે 900 સર્વોચ્ચ શક્ય સ્કોર છે. 700થી વધુ સ્કોર સામાન્ય રીતે ઉત્તમ માનવામાં આવે છે.

કેડિટ રિપોર્ટ શું છે?

કેડિટ રિપોર્ટ ઋણદારની વ્યાપક ધિરાણ રૂપરેખા આલેખિત કરે છે. આમાં, દાખલા તરીકે, અંગત માહિતી (એટલે કે, ઋણદારનું નામ, આઈડી નંબર, જન્મતારીખ વગેરે) અને કેડિટ સમરી (દા.ત. ઋણદાર દ્વારા ધરાવાતા કેડિટ અકાઉન્ટ્સ, અકાઉન્ટમાં વર્તમાન / ભૂતકાળમાં લેણું છે કે કેમ અને ઋણદાર વિશે કરાયેલી તાજેતરની ધિરાણ પૂછપરછની નોંધ)નો સમાવેશ થાય છે.

બેન્ક સીઆરઆઈએફ કેડિટ રિપોર્ટનો અર્થ શું થાય છે?

જો અમને સીઆરઆઈએફ ડેટાબેઝ પર તમારે માટે કોઈ ડેટા લોકેટ નહીં કરી શકીએ તો તમને ‘એચએન’ મળશે, જેનો અર્થ નો હિસ્ટરી રિપોર્ટ એવો થાય છે.

મને 11-18નો સ્કોર ક્યારે મળશે?

નિમ્નલિખિત સ્થિતિઓમાં તમને 11-18 વચ્ચે સ્કોર પ્રાપ્ત થવાની શક્યતા છે:

ગ્રાહક માટે:

અગિયાર સ્કોર નથી, પરંતુ તે એક્સકલુઝન કોડ છે અને 50થી વધુ સક્રિય અકાઉન્ટ્સ હોય તેવા નાગરિકોને તે અપાય છે.

બાર સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને અમે વર્ગીકૃત નહીં કરી શક્યા હોય તેવા નાગરિકોને તે અપાય છે.

ચૌદ સ્કોર નથી, પરંતુ તે એક્સકલુઝન કોડ છે અને અગાઉની કોઈ કેડિટ હિસ્ટરી નહીં હોય, પરંતુ લોન માટે બાંચધરી આપી હોય તેવા નાગરિકોને તે અપાય છે.

પંદર સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને જેમની પૂરતી કેડિટ હિસ્ટરી ઉપલબ્ધ નહીં હોય તેવા નાગરિકોને તે અપાય છે.

સોળ સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને 36 મહિનાની અંદર બધાં અકાઉન્ટ્સ બંધ કરાય અને પૂછપરછની તારીખથી ગત 36 મહિનામાં કોઈ નવી લોન લીધી નહીં હોય તેવા નાગરિકોને તે અપાય છે.

સત્તર સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને ગ્રાહક વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ નહીં હોય તે કિસ્સામાં અપાય છે.

અઠાર સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને છેલ્લા 36 મહિનામાં વ્યક્તિગત સામે કોઈ અપડેટ નહીં હોય ત્યારે અપાય છે.

કર્મચીયલ માટે:

તેર સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને બ્યુરોમાં સુસંગત અપડેટ્સ ઉપલબ્ધ નહીં હોય તે સંસ્થાઓને અપાય છે.

ચૌદ સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને રેટિંગ કરવા માટે ઘણા બધા કોન્ટ્રાક્ટ્સ હોય તેવી સંસ્થાઓને તે અપાય છે.

પંદર સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને ઋણદારો કર્મચીયલ સંસ્થાઓ નહીં હોય તેમને તે અપાય છે.

સોળ સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને જે સંસ્થાઓ વર્ગીકૃત નહીં કરી શકાય તેમને તે અપાય છે.

સત્તર સ્કોર નથી, પરંતુ એક્સકલુઝન કોડ છે અને ગત કેડિટ હિસ્ટરી નહીં ધરાવતી હોય, પરંતુ લોન માટે બાંચધરી આપી હોય તેવા સંસ્થાઓને તે અપાય છે.

કેડિટ રિપોર્ટના ઉપલબ્ધ વિકલ્પો અને તેમનો ખર્ચ કેટલો છે?

સીઆરઆઈએફ હાઈ માર્ક પાસેથી તમારો કેડિટ રિપોર્ટ મેળવવા માટે 3 વિકલ્પ ઉપલબ્ધ છે:

ફ્રી કેડિટ રિપોર્ટ: તમે વર્ષમાં એક વાર સીઆરઆઈએફ પાસેથી એક સંપૂર્ણ મફત વાર્ષિક કેડિટ રિપોર્ટ પ્રાપ્ત કરવા માટે હકદાર છો. આ રિપોર્ટ તમને જોવા માટે તુરંત ઉપલબ્ધ કરાય છે.

પેઈડ રિપોર્ટ (સબ્સ્ક્રિપ્શન પ્લાન થકી): તમે ખરીદી કરેલા પ્લાન અનુસાર લાગુ મુકરર સમયગાળા માટે તુરંત તમારો કેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો. પ્લાનમાં 1 વર્ષ, 6 મહિના, માસિક અને વન ટાઈમનો સમાવેશ થાય છે. સર્વ સબ્સ્ક્રિપ્શન પ્લાન તમને કેડિટ સ્કોર સાથે કેડિટ રિપોર્ટ ઓફર કરે છે.

પેઈડ રિપોર્ટ (સ્કોર વિના): તમે સીઆરઆઈએફ પાસેથી રૂ. 99 (જીએસટી સમાવિષ્ટ નથી) વિના તુરંત તમારો કેડિટ રિપોર્ટ પ્રાપ્ત કરી શકો છો. આ એક જ વાર કરી શકશો.

પર્સનલ કેડિટ સ્કોર શું છે?

પર્સનલ કેડિટ સ્કોર કોઈ પણ વ્યક્તિની નાણાકીય સ્થિતિનું માપન છે. તમે ઋણ પુનઃચુકવણી કરવાની કેટલી શક્યતા છે તેની સાથે તે સંબંધિત છે. બેન્કો અને ધિરાણદારો તમને કેડિટ કાર્ડ અથવા લોન મંજૂર કરવી કે નહીં તે નક્કી કરવા તેનો ઉપયોગ કરે છે. ભારતમાં કેડિટ સ્કોર 300થી 900 વચ્ચે હોય છે. 700થી વધુ સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે.

બિઝનેસ ક્રેડિટ સ્કોર શું છે ?

વ્યક્તિગતોની જેમ વેપારોને પણ ક્રેડિટ સ્કોર અપાય છે. કંપની અથવા બિઝનેસ ક્રેડિટ સ્કોર કંપનીની ધિરાણ પાત્રતા નક્કી કરે છે. એટલે કે, તે લોન પરતફેડ કરવાની કેટલી શક્યતા છે. દરેક બેન્ક અથવા એનબીએફસે કાર્યશીલ મૂડી લોન અથવા ઈક્વિપમેન્ટ ખરીદી કરવા માટે લોન તમારા વેપાર અથવા કંપનીને મંજૂર કરવા પૂર્વે વેપારનો ક્રેડિટ સ્કોર અને હિસ્ટરી સાથે પ્રમોટર (અંગત)નો ક્રેડિટ સ્કોર ધ્યાનમાં લે છે.

મને સીઆરઆઈએફનો બિઝનેસ ક્રેડિટ રિપોર્ટ (બીસીઆર) કઈ રીતે મળી શકે ?

તમને ફક્ત 3 આસાન પગલાંમાં તમારો બિઝનેસ ક્રેડિટ સ્કોર અને રિપોર્ટ મળી શકે છે.

પગલું 1: તમારી વેપારની વિગતો ભરો, જેમ કે, વેપાર, પેન, સરનામું, અધિકૃત સહીકર્તાનું નામ, અધિકૃત સહીકર્તાનો પેન.

પગલું 2: ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ/ નેટ બેન્કિંગની વિગતોનો ઉપયોગ કરીને તમારા રિપોર્ટ માટે ચુકવણી સંરક્ષિત કરો.

પગલું 3: તમારા દસ્તાવેજો અપલોડ કરો, જેમ કે, પેનની સ્કેન કરેલી કોપી, સરનામાનો પુરાવો, અધિકૃત પત્ર વગેરે.

તમારો રિપોર્ટ સુપરત દસ્તાવેજોની સફળ ખરાઈ કરવા પર 7 કામકાજના દિવસમાં તમને મોકલવામાં આવશે.

મને સીઆરઆઈએફ પર્સનલ ક્રેડિટ રિપોર્ટ (પીસીઆર) કેટલા સમયમાં મળી શકશે ?

તમને 3 આસાન પગલાંમાં તમારો સીઆરઆઈએફ ક્રેડિટ રિપોર્ટ મળી શકે છે:

પગલું 1: તમારી વિગતો, ઓળખના પુરાવા અને સરનામું ભરો: તમને સૌપ્રથમ તમારી ઇમેઈલ આઈડી આપવા પૂછવામાં આવશે, જે પછી તમને બાકી વિગતોની આવશ્યકતા માટે ફોર્મ અપાશે, જેમાં આખું નામ, મોબાઈલ નંબર, જન્મતારીખ, નિવાસી સરનામું અને લિંગ ભરવાના રહેશે. તમારે તમારી ઓળખની વિગતો પણ સુપરત કરવાની રહેશે, જેમ કે, પેન નંબર, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ નંબર, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા કોઈ પણ અન્ય આઈડી.

પગલું 2: તમારા રિપોર્ટનો પ્રકાર પસંદ કરો: તમારી પાસે ત્રણ વિકલ્પો રહેશે:

ફ્રી ક્રેડિટ રિપોર્ટ: તમે વર્ષમાં એક વાર સીઆરઆઈએફ પાસેથી એક સંપૂર્ણ મફત વાર્ષિક ક્રેડિટ રિપોર્ટ પ્રાપ્ત કરવા માટે હકદાર છો. આ રિપોર્ટ તમને જોવા માટે તુરંત ઉપલબ્ધ કરાય છે.

પેઈડ રિપોર્ટ (સબ્સ્ક્રિપ્શન પ્લાન થકી): તમે ખરીદી કરેલા પ્લાન અનુસાર લાગુ મુકરર સમયગાળા માટે તુરંત તમારો ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો. પ્લાનમાં 1 વર્ષ, 6 મહિના, માસિક અને વન ટાઈમનો સમાવેશ થાય છે. સર્વ સબ્સ્ક્રિપ્શન પ્લાન તમને ક્રેડિટ સ્કોર સાથે ક્રેડિટ રિપોર્ટ ઓફર કરે છે.

પેઈડ રિપોર્ટ (સ્કોર વિના): તમે સીઆરઆઈએફ પાસેથી રૂ. 99 (જીએસટી સમાવિષ્ટ નથી) વિના તુરંત તમારો ક્રેડિટ રિપોર્ટ પ્રાપ્ત કરી શકો છો. આ એક જ વાર કરી શકશો.

પગલું 3: તમારી પૂછપરછની ખરાઈ કરો: તમે સર્વ વિગતો ભરો અને તમારા રિપોર્ટનો પ્રકાર પસંદ કરો તે પછી તમારી ઓળખના સમર્થન માટે તમને બહુ પસંદગી પ્રશ્નોના ઉત્તરો પૂછવામાં આવશે. તમને તમારી ગત લોન અથવા ક્રેડિટ કાર્ડસને આધારે ત્રણ પ્રશ્ન પુછાશે. ત્રણમાંથી એક પ્રશ્નનો સફળતાથી ઉત્તર આપવા પર તમને તમારી નોંધણીકૃત ઇમેઈલ આઈડી પર તમારો રિપોર્ટ અપાશે.

વધુ માહિતી માટે તમને અમારો બ્લોગ પણ વાંચી શકો છો:

<https://blog.crifhighmark.com/how-to-find-your-crif-credit-score/>

શું ડાઉનલોડ કરેલો ક્રેડિટ રિપોર્ટ પાસવર્ડ સુરક્ષિત છે ?

હા, ડાઉનલોડ કરેલો પાસવર્ડ સુરક્ષિત છે. પાસવર્ડ 8 કેરેક્ટરનો છે. તે તમે એન્ટર કરેલી વિગતો અનુસાર તમારા નામના પ્રથમ ચાર અક્ષરો (લોઅર કેસમાં) અને અક્ષરો અને તમારા મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડાનું સંયોજન રહેશે. દાખલા તરીકે, જો વિગતોમાં તમારું નામ C.K. AJAY KUMAR હોય અને મોબાઈલ નંબર 9900123456 હોય તો તમારો પાસવર્ડ C.K.3456 હશે.

મારો પાસવર્ડ રિસેટ કઈ રીતે કરી શકું ?

જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે લોગઈન વિકલ્પ પર ક્લિક કરીને તે બદલી શકો છો અને પોપઅપમાંથી “I don’t remember my password” લિંક પસંદ કરી શકો છો.

મને મારા સીઆરઆઈએફ ક્રેડિટ રિપોર્ટની કોપી કઈ રીતે મળી શકશે ?

તમારે વિનંતી customerservice@crifhighmark.com પર મોકલવાની રહેશે. કૃપા કરી વિષય તરીકે તમારી રિપોર્ટ આઈડી ઉલ્લેખ કરો અને તમારો સીએચએમ બ્યુરો રિપોર્ટની કોપી માટે પૂછો.

ક્રેડિટ સ્કોર કેટલી વાર અપડેટ કરાય છે ?

લાક્ષણિક રીતે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ગ્રાહક ધિરાણ માહિતી પગલાડિયે સીઆરઆઈએફને સુપરત કરે છે. તેના સભ્યો પાસેથી આ ડેટા પ્રાપ્ત થવા પર સીઆરઆઈએફ તે અનુસાર ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (સીઆઈઆર) અપડેટ કરે છે.

ક્રેડિટ સ્કોરને કયાં પરિબળો અસર કરે છે ?

તમારા સીઆરઆઈએફ ક્રેડિટ સ્કોરને પાંચ મહત્વપૂર્ણ પરિબળો અસર કરી શકે છે:

1. પેમેન્ટ હિસ્ટરી: તમેતમારા ઇએમઆઈ અથવા કાર્ડ પરનાં લેણાં કેટલી વાર સમયસર ભરો છો ? વિલંબિત ચુકવણીથી ક્રેડિટ સ્કોર નીચે

આવે છે.

2. ઉચ્ચ ધિરાણ ઉપયોગિતા: તમે તમારી કુલ ક્રેડિટમાંથી કેટલી ઉપયોગ કરી છે? તમારા ક્રેડિટ કાર્ડની વર્તમાન બેલેન્સમાં વધારો સંકેત આપે છે કે પુનઃચુકવણીનો બોજ વધ્યો છે અને તમારા સ્કોરને નકારાત્મક અસર કરી શકે છે.

3. ક્રેડિટ હિસ્ટરીની લંબાઈ: તમારી ક્રેડિટ હિસ્ટરી કેટલી લાંબી છે? જવાબદાર ક્રેડિટના ઉપયોગની લાંબી હિસ્ટરી હોય તેમ તમારો સ્કોર ઉચ્ચ રહેવાની શક્યતા છે.

4. ક્રેડિટ સંમિશ્રણ: શું તમે એકથી વધુ લોન ધરાવો છો? લોનના અલગ અલગ પ્રકાર સાથે અનુભવ (દા.ત. કાર લોન, હોમ લોન અથવા ક્રેડિટ કાર્ડ) તમારા સ્કોરમાં મદદ કરી શકે છે.

5. નવું ક્રેડિટ: શું તમે તાજેતરમાં નવી ક્રેડિટ રેખા ખોલી છે? ટૂંકા સમયગાળામાં અનેક અકાઉન્ટ્સ ખોલાવવાથી તમારો ક્રેડિટ સ્કોર નીચે આવી શકે છે.

વધુ માહિતી માટે અમારો બ્લોગ વાંચો:

<https://blog.criifhighmark.com/everything-that-can-and-cant-affect-your-credit-score>

શું તમારા સીઆરઆઈએફ હાઈ માર્ક ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (સીઆઈઆર) બાબતે કોઈ ફરિયાદ/ વિખવાદ છે?

1. તમારા સીઆઈઆરમાં સીઆરઆઈએફ હાઈ માર્ક રેફરન્સ નંબર જુઓ. (તમારો લેબલ એચએમ રેફ. # પછી સીઆરઆઈએફ હાઈ માર્ક સીઆઈઆરમાં મોજૂદ નંબર તમારા સીઆરઆઈએફ હાઈ માર્ક સીઆઈઆરના ટોચ પર જમણા ખૂણામાં છે).

2. ઈમેઈલ અહીં મોકલો: customerservice@criifhighmark.com (અથવા વિષય રેખામાં સીઆરઆઈએફ હાઈ માર્ક રેફરન્સ નંબર સાથે અમારો સંપર્ક કરો @ 020 67157760/88 પર. મેઈલમાં તમારી ફરિયાદ વિશે વિગતોનો ઉલ્લેખ કરો, જેમ કે, (સીઆઈઆરમાં અકાઉન્ટનો સિરિયલ નંબર, ફરિયાદ કરાયેલી અકાઉન્ટની માહિતી વગેરે), તમારો સંપર્ક નંબર અને નામ.

3. સીઆરઆઈએફ હાઈ માર્ક તમને ટિકિટ નંબર મોકલશે, જે તમે સીઆરઆઈએફ હાઈ માર્ક સાથે વધુ ચર્ચા માટે સંદર્ભિત કરી શકો છો.

4. સીઆરઆઈએફ હાઈ માર્ક તમારી નોંધ કરાયેલી ફરિયાદમાં તપાસનાં પરિણામોને આધારે તમારી ફરિયાદની પ્રાપ્તિના 30 દિવસમાં જો સીઆરઆઈએફ હાઈ માર્ક પ્રક્રિયાને લીધે બિન-અચૂકતા નોંધાઈ હોય તો સીઆરઆઈએફ હાઈ માર્ક પાસે મૂળમાં પૂછપરછ કરનારી ધિરાણ સંસ્થાને સુધારિત સીઆઈઆર અપાશે અથવા ધિરાણ સંસ્થા દ્વારા અપાયેલા ડેટાને લીધે બિનઅચૂકતા નોંધાઈ હોય તો સુધારિત ધિરાણ માહિતી માગશે.

5. ઉક્ત પ્રક્રિયા પૂર્ણ થવા પર સીઆરઆઈએફ હાઈ માર્ક તમારી ફરિયાદનો અનુરૂપ ટિકિટ નંબર બંધ કરશે. દેખરેખ રાખતું પ્રશાસન (એટલે કે, ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા). જેના સંબંધમાં માહિતી હોય તે ગ્રાહક.

વધુ માહિતી માટે કૃપા કરી અમારા બ્લોગની વિકિટ કરો

<https://blog.criifhighmark.com/how-when-to-dispute-your-credit-information-report/>

મારો ક્રેડિટ સ્કોર સુધારવા માટે શું કરવું જોઈએ?

તમે ધિરાણદાર દ્વારા મંજૂર લોન માટે મહત્વપૂર્ણ ઉત્તમ ધિરાણ ઇતિહાસ જાળવી રાખીને તમારો સીઆરઆઈએફ ક્રેડિટ સ્કોર સુધારી શકો છો. તમારો સ્કોર બહેતર બનાવવા માટે આ 7 પગલાંનું પાલન કરો:

1. તમારાં લેણાં સમયસર ચૂકવો: તમારાં સર્વ લેણાં સમયસર પરતફેડ કરો. તમે તમારા ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરો છો ત્યારે ઉપયોગ ચાલુ રાખવા માટે આવશ્યક લઘુત્તમ રકમ જ ચૂકવવાનું ટાળો. તે મહિના માટે તમને પરવડી શકે તેમ સંપૂર્ણ અથવા મહત્તમ રકમ ચૂકવવાની ખાતરી રાખો.

2. તમારાં ક્રેડિટ કાર્ડની સંખ્યા ઓછી કરો: તમારી ધિરાણ મર્યાદા વધારવાની અને ખર્ચનું પ્રમાણ ઘટાડવાની એક ઉત્તમ રીત એક સમયે 3થી વધુ ક્રેડિટ કાર્ડ નહીં ધરાવવાની છે.

3. તમારા ક્રેડિટ કાર્ડનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો: તમારો ખર્ચ તમારી ધિરાણ મર્યાદાના 30-35 ટકાની શ્રેણીમાં નિયંત્રિત રાખવાના વાલાલખ્યા નિયમ સાથે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બહુ વ્યવહારુ છે.

4. જૂનું એ સોનું: તમે સંપૂર્ણ લેણાં ચૂકવી દીધા પછી અકાઉન્ટમાંથી તમારી નોંધ ભૂંસી નાખવાની ઉતાવળ નહીં કરો, કારણ કે સમયસર ઈએમઆઈની ચુકવણીનું પગેરું સ્કોરને ઉત્તમ રીતે વધારે છે.

5. તમારી લોન અરજીઓ મર્યાદિત કરો: અન્ય બેન્ક પાસે પુનઃ અરજી કરવાની ઉતાવળ નહીં કરો, કારણ કે તેમને ગત બેન્ક દ્વારા તમને નકાર અપાયો તે જોઈ શકશે. આથી તમારા ક્રેડિટ સ્કોરને વધુ અસર થશે અને મામલો કથળશે.

6. પૂછપરછ કરતી વખતે સાવધાન રહો: જો સતત અતિ ધિરાણ લેવાની અરજી કરો છો એવી છાપ ટાળવા માટે નવા ધિરાણ માટે સાવચેતીથી અરજી કરો.

7. તમારા સ્કોરનું પગેરું રાખો: તમારો ક્રેડિટ સ્કોર નિયમિત તપાસવો તે ઉત્તમ અને હાનિરહિત વ્યવહાર છે. તે તમારી નાણાકીય સ્થિતિની પર નજર રાખવામાં તમને મદદ થાય છે અને તે અનુસાર તેમાં સુધારણા કરવા પૂરતાં પગલાં લઈ શકો છો. તમે તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો અને સીઆરઆઈએફ સેવાઓ ઉપલબ્ધ કરીને વિગતવાર અહેવાલ પ્રાપ્ત કરો.

વધુ માહિતી માટે કૃપા કરી વિકિટ કરો: <https://blog.criifhighmark.com/7-surefire-ways-to-improve-your-credit-score/>